



## નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ (કલ્પવૃક્ષ)



"ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ (પામ્સ) ફોર કોકોનાટ રીસર્ચ"

(અભિલ ભારતીય સંકલિત નાળિયેરી સંશોધન યોજના)

:લેખક:

ડૉ. પંકજ પી. બાલેરાવ, ડૉ. બી. વી. પટ્ટિયાર, ડૉ. એસ. જે. પાટીલ અને ડૉ. એન. એલ. પટેલ  
અસ્પી બાગાયત-૧-વનીય મહાવિદ્યાલય  
ન. કુ. યુ., નવસારી ઉદ્દેશ ૪૫૦



નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી

યુનિવર્સિટી પ્રકાશન નંબર: ૧૭/૨૦૧૩-૧૪

## નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ (કલ્પવૃક્ષ)

ડૉ. પંકજ પી. ભાલેરાવ, ડૉ. બી. વી. પટ્ટિયાર, ડૉ. એસ. જે. પાટીલ અને ડૉ. એન. એલ. પટેલ  
અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય  
ન. કુ. યુ., નવસારી ઉદ્દેશ ૪૫૦

લોક જીવનમાં લગ્નની માંડી અને કહેવતોમાં નાળિયેરે જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળિયેરને 'શ્રીફળ' શ્રી એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. નાળિયેરીને "કલ્પવૃક્ષ" અથવા "સ્વર્ગના જાડ" તરીકે પણ ઓળખાય છે કારણ કે નાળિયેરીના બધા જ ભાગો જેવા કે મૂળ, થડ, પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમજ ઉદ્ઘોગમાં થાય છે. દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી છે. ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર ૨૦,૮૮૨ હેક્ટર વિસ્તારમાં છે. નવસારી, વલસાડ, સુરત, જુનાગઢ, કચ્છ અને ભાવનગર જિલ્લાઓમાં નવું વાવેતર થવાની ઉજળી તકો છે.

### હવામાન :

આ પાકને દરિયાકાંઠાનું સમધાત હવામાન ઘણું માફક આવે છે. ઉષ્ણતામાનમાં બહુ જ મોટા ફેરફાર ન થતાં જ્યાં ભેજનું પ્રમાણ બારેમાસ જળવાઈ રહેતું હોય તેવું હવામાન નાળિયેરીનાં ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ છે. જે વિસ્તારનું સરેરાશ ઉષ્ણતામાન ૨૧૦ સે. થી નીચે રહેતું હોય ત્યાં જાડનાં ફૂલના કાતરા નીકળવાનું બંધ થઈ જાય છે.

### જમીન :

નાળિયેરીનો પાક નબળી નિતારશક્તિવાળી ક્ષારીય અને સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ, કાંપવાળી જમીન વધુ અનુકૂળ આવે છે.

### નાળિયેરીની જાતો :

નાળિયેરીમાં ત્રણ પ્રકારની જાતો હોય છે. પંચિયમ કિનારાની ઉચ્ચી જાત, ઢીગણી અને હાઈબ્રિડ જાતો પંચિયમ કિનારાની ઉચ્ચી જાત, ઢીગણી (લીલી) અને હાઈબ્રિડ ટી × ટી અને ટી × ટી જાતોના ગુણધર્મો બિન્ન પ્રકારના છે અને દરેકની અલગ ખાસિયતો છે જે નીચે જણાવેલ કોઠામાં દર્શાવેલ છે.

જાત	ઉચ્ચાઈ (મી.)	ફળ આવવાની શરૂઆત	સરેરાશ ઉત્પાદન (ફળ/જાડ/વર્ષ)	સરેરાશ કોપરાનું વજન (ગ્રામ/ફળ)	અગત્યની ખાસિયતો
પંચિયમ કિનારાની ઉચ્ચી જાત	૧૮-૨૫	૫ થી ૭	૬૦-૭૦	૧૬૫	૧) પાણી તથા પાકા ફળ માટેની જાત ૨) પરપરાગનયનથી ફળ બંધાય છે તેથી ફળ તથા જાડમાં ઘણી બિન્નતા જોવા મળે છે.
લીલી ઢીગણી	૧૦-૧૫	૩.૫ થી ૪	૬૦-૬૫	૬૦	૧) કાચા પાણી માટેની જાત (તરોકા માટેની ખાસ જાત) ૨) સ્વપરાગનયનથી ફળ બંધાય છે. ૩) માદા ફળો વધુ ઉત્પન્ન કરે પણ ફળોનું સેટીગ ઓછું થાય છે.
હાઈબ્રિડ ટી × ટી	૧૫-૨૦	૪ થી ૫	૧૦૦-૧૨૦	૧૬૦	પાણી તથા પાકા ફળ માટેની જાત
હાઈબ્રિડ ટી × ટી	૧૫-૨૦	૪ થી ૪.૫	૧૦૦-૧૨૦	૧૬૦	૧) લૂમોને ટેકાની જરૂર પડે છે. ૨) પાણી તથા પાકા ફળ માટેની જાત

ઉપર જણાવેલ જાતોમાંથી હાઈબ્રિડ ટી × ટી જાતને ગુજરાત રાજ્યમાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે.

## સર્વધન :

નાળિયેરીનું સંવર્ધન બીજ દ્વારા તેમજ પરપરાગનયનથી ફલિનીકરણ દ્વારા થતું હોઈ ભિન્નતા ખૂબ જ જોવા મળે છે. રોપ ૮-૧૨ માસની ઉમરનો ૪-૮ તંદુરસ્ત પાનવાળો હોવો જોઈએ.

## માતૃજાડની પસંદગી :

જાડ ૨૫ થી ૪૦ વર્ષની ઉમરનું રોગજીવાતથી મુક્ત હોવું જોઈએ. દર વર્ષ ૧૨ થી ૧૪ નવા પાન નીકળતા હોવા જોઈએ તથા દરેક પાનના કક્ષમાંથી પુષ્પવિન્યાસ નીકળતો હોવો જોઈએ. જાડનું થડ સીંહું અને ઊંઠ થી ૪૦ તંદુરસ્ત પાન ધરાવતું અને પાનની ગોઠવણી છત્રી આકારે થયેલ હોવી જોઈએ. પુષ્પદંડ ટૂંકો અને જાડ ૮૦ થી વધુ મોટા ગોળથી લંબગોળ ફળ દર વર્ષ આપતું હોવું જોઈએ.

## બીજની પસંદગી :

પસંદ કરેલ માતૃજાડમાંથી પરિપક્વ (૧૧ થી ૧૨ માસના) નાળિયેરને ઉતારી તેમાંથી મોટા કદના ગોળાકારથી લંબગોળ કદના, રોગજીવાત મુક્ત નાળિયેરને પસંદ કરી છાયામાં એક થી દોઢ માસ આરામ આપવો.

## રોપ ઉછેર :

નાળિયેર બીજમાં પ્રમાણસર પાણી હોય તેવા નાળિયેર બીજને નર્સરીની અંદર ઊંઠ ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના અંતરે બીજનું મુખ જમીન ઉપર ખૂલ્યું રહે તે રીતે ઉભા વાવવા. ત્યારબાદ નિયમિત જરૂર મુજબ પાણી આપતા રહેવું. વાકેતર બાદ પાંચ માસે ૧૮૦ કિલો નાઈટ્રોજન (૬૦ કિલો યુરિયાના રૂપમાં તથા ૮૦ કિલો એરંડીના ખોળના રૂપમાં) પ્રતિ હેક્ટારે આપવાથી રોપની વૃદ્ધિ સારી જોવા મળેલ છે. નર્સરીમાં જરૂર મુજબ નીદામણ તેમજ પાકસંરક્ષણના પગલાં લેવા.

## રોપની પસંદગી :

એક અભ્યાસ મુજબ નાળિયેરીના સારી ગુણવત્તાવાળા રોપની પસંદગીથી ૧૫ % ઉત્પાદનમાં વધારો નોંધાયેલ છે માટે રોપની પસંદગી ખૂબજ અગત્યનું પાસું કહી શકાય. રોપની પસંદગી સમયે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે :

- (૧) રોપ ૮ થી ૧૨ માસનો હોવો જોઈએ.
- (૨) રોપના થડનો ઘેરાવો જેમ વધુ તેમ રોપ વધુ સારો.
- (૩) ઉમર પ્રમાણે ૪ થી ૮ તંદુરસ્ત લીલા પાન ધરાવતો તથા રોગ-જીવાતથી મુક્ત હોવો જોઈએ.

## રોપણી :

દેશી તથા હાઇથ્રીડ જાત માટે ૭.૫ મીટર × ૭.૫ મીટર અને ટીગણી જાત માટે ૬ મીટર × ૬ મીટરનું અંતર બે હાર અને હારમાં બે જાડ વચ્ચે રાખવું હિતાવહ છે. નાળિયેરી રોપવા માટે ખાડાનું માપ ૧ મીટર × ૧ મીટર × ૧ મીટર અથવા ૬૦ સે.મી. × ૬૦ સે.મી. માપના ખાડા ખોદવા. ખાડાને ૧૦-૧૫ ટિવસ તડકામાં બરાબર તપવા દઈ માટી સાથે ૨૦ કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર તથા ૨૫૦ ગ્રામ ડી.એ.પી. અને ૫૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તથા ઉધર્ના નિયંત્રણ માટે કલોરપાયરીઝેસ ૨૦% ઈ.સી. ૨૦ મી લી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ખાડો ભરવો.

## ખાતર :

નાળિયેરીના પાકને ૧.૫-૦.૭૫૦-૧.૫ કિ. ગ્રા. ના.ફો.પો/આડ/વર્ષ પ્રમાણે ખાતર આપવાની ભલામણ છે. તથા જાડ દીઠ ૫૦ કિ. ગ્રામ છાણિયું ખાતર આપવું. રાસાયણિક ખાતર જાડ ફરતે નીક બનાવી આપવું. નાળિયેરીના લગભગ ૮૦ ટકા મૂળ થડ ફરતે ૨ મીટરના ઘેરાવામાં આવેલ હોય થડથી ૨ મીટરના ઘેરાવામાં ખાતર આપવું. ખાતરો બે સરખા હપ્તામાં જૂન-જુલાઈ અને

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આપવું. ચોમાસામાં લીલો પડવાશનો પાક લઈ કૂલ આવવાની શરૂઆત થાય કે તરત જ ખામણામાં દાટી દેવો જોઈએ. લીલોળીનો ખોળ પ કિલો/જાડ આપવો જોઈએ. ખાતરો કોઠામાં દર્શાવ્યા મુજબ આપવા.

### નાળિયેરીમાં પ્રતિ વર્ષ જાડ દીઠ ખાતરોની ભલામણ (કિ.ગ્રા.)

વર્ષ	છાણિયું ખાતર	યુરીયા	સિંગલ સુપર ફોસ્ફેટ	મ્યુરેટ ઓફ પોટાશ
૧	૫	૦.૩૨૬	૦.૪૬૮	૦.૨૫૦
૨	૧૫	૧.૦૮૭	૧.૫૬૨	૦.૮૩૩
૩	૩૦	૨.૧૭૪	૩.૧૨૫	૧.૬૬૬
૪	૫૦	૩.૨૬૧	૪.૬૮૮	૨.૫૦૦

### પિયત :

શરૂઆતના ત્રણ વર્ષ દરમ્યાન જમીનની પ્રતિ પ્રમાણે નાળિયેરીના જાડને નિયમિત પૂરતા જથ્થામાં એટલે કે શિયાળામાં ૮ થી ૧૨ દિવસે તથા ઉનાળામાં ૪ થી ૬ દિવસે પિયત આપતા રહેવું. શરૂઆતના પ્રથમ વર્ષમાં ખામણા એક મીટરના ચોરસ અથવા તો ગોળ બનાવવા. ત્યારબાદ પ્રતિ વર્ષ ખામણાનાં કદમાં વધારો કરતા રહેવું, જે ચોથા વર્ષ ૪ મીટરના ચોરસ અથવા ૨.૫ મીટરના ત્રિજ્યાના ઘેરાવાના ગોળ ખામણાં કરી ખામણામાં પાણી પૂરતું ભરાય તે રીતે પિયત આપવું. એક વર્ષની પાણીની ખેંચ બગીચાનું બે વર્ષનું ઉત્પાદન ઘટાડે છે. નાળિયેરીના પાકમાં ૨૫૯ પિયત પદ્ધતિથી પાણી આપી શકાય.

### અંતરપાકો :

નાળિયેરીનાં બગીચામાં શરૂઆતનાં વર્ષમાં બધા જ પાકો મિશ્રપાક તરીકે લઈ શકાય છે. ત્યારબાદ છાંયામાં થતા પાકો જેવા કે આંદુ, હળદર, સુરણ જેવા પાકો ઉંધેરી શકાય છે. જાડ અથવા નાળિયેરીના રોપની નર્સરી મોટા થઈ ગયા પછી નાળિયેરીમાં ઘઉ, રજકો, જુવાર, શાકભાજી વગેરે પાકો લઈ શકાય છે. જે વિસ્તારમાં મીઠા પાણીની પૂરતી સગવડતા હોય ત્યાં કેળ, સોપારી, મરી, નાગરવેલ જેવા બાગાયતી પાકો પણ લઈ શકાય છે. દક્ષિણ ભારતમાં એકમ વિસ્તારમાં સોપારી, કોકો અથવા કોઝી, નાળિયેરી અને સોપારીના જાડ પર મરી ચઢાવી વધારાની પૂરક આવક મેળવવામાં આવે છે.

### જીવાતો અને રોગો :

૧. કાળા માથાવાળી ઈયળ : આ જીવાત ઈયળ અવસ્થામાં પાનની પણીમાં નીચે બોગાંદાં જેવું ઉધૃણી માફક બનાવી પાનનો લીલો ભાગ ખાઈ જાય છે અને ઉપદ્રવનું પ્રમાણ વધી જાય તો પાન સફેદ રંગના થઈ જાય છે અને ભારે ઉપદ્રવના સમયે ફળનું કદ નાનું રહેવું, ખરી પડવા વગેરે પ્રશ્નો ઉભા થાય છે.

નિયંત્રણ : ડીડીવીપી (ડાયકલોરોહોસ) ૦.૦૨% (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. દવા) નો છંટકાવ કરવો.

૨. ગેડા કીટક : આ કીટક ખાસ કરીને નવા નીકળતા પાનની નીચે (થડમાં) કાણું પાડી પાનને ચાવી નાખે છે તથા કૂચા બહાર કાઢે છે. જયારે પાન બહાર નીકળે ત્યારે પંખા જેવા આકારાનું કપાયેલું જોવા મળે છે. નાના જાડમાં આ કીટકનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

### નિયંત્રણ :

- (૧) થડમાં કાળાવાળા ભાગમાં ત્રાક આકારનો સળીયો નાખી કીટકને બહાર કાઢી નાશ કરવો.
- (૨) કાળામાં કીટકનાશક દવા (કલોરપાઈરીફોસ ૨૦% ઈ.સી ) નાખી બંધ કરી દેવું.
- (૩) બગીચો ચોખ્ખો રાખવો કારણ કે આ કીટક સરી ગયેલ કચરાના ઢગલામાં વંશવૃદ્ધિ કરે છે.
- (૪) ખાતરના ખાડામાં ૧૫ થી ૨૦ દિવસે ૨ ટકા પેરાથીઓન પાઉડરનો છંટકાવ કરતા રહેવો.
- (૫) પ્રકાશપિંજરનો ઉપયોગ કરી કીટકોનો નાશ કરવો.

૩. ઉદર : નાળિયેરીના બગીચામાં ઉદર કાચા નાળિયેરમાં મુખ આગળ કાણું પાડી પાણી પી જાય છે.

#### નિયંત્રણ :

(૧) નાળિયેરના થડ ઉપર ૨ થી ૨.૫ મીટરની ઉચાઈએ ૨૬ ગેજના ગેલ્વેનાઈઝ અથવા એલ્યુમિનિયમના પતરાના ૩૦ સે.મી.

પહોળા પણ અથવા શંકુ આકારના પતરા લગાડવા.

(૨) બ્રોમાડીઓલોનની તૈયાર વેક્સ કેક જાડ ઉપર મૂકવી.

#### ૪. નાળિયેરીની કથીરી :

ગુજરાતમાં નાળિયેરીની કુલ ત્રણ પ્રકારની કથીરી જોવા મળે છે. જે પેકી ઈરીયોફીડ કુળની કથીરીથી આર્થિક નુકસાન નોંધાયેલ છે. જ્યારે ટેન્યુપાલ્પીડ કુળની લાલ કથીરી અને ટેટ્રાનીકીડ કુળની કથીરીનું આર્થિક નુકસાન પ્રમાણમાં ઓછું નોંધાયેલ છે.

ઇરીયોફીડ કુળની કથીરી, સફેદ રંગની, બે જોડ પગ ધરાવતી કૃમિ આકારની અને ખૂબ જ સૂક્ષ્મ હોય છે. જે નરી આંખે જોઈ શકતી નથી આથી તેનો ઉપદ્રવ ફળ ઉપરનાં નુકશાનના ચિંહો પરથી જાણી શકાય છે. તેના ઉપદ્રવની શરૂઆત માદા કુલ તેમજ દાંડીઓથી થાય છે. ફ્લીનીકરણ બાદ ત થી ૬ માસનાં ફળોમાં કથીરી તેના સોય જેવા મુખાંગો દ્વારા ફળની વિકાસ પામતી પેશીઓમાં આવરણની નીચે રહી રસ ચૂસીને નુકશાન કરે છે. પરિણામ સ્વરૂપ ફળના શરૂઆતના ભાગમાં આવેલ પેશીઓ મરી જાય છે. ખૂબ જ ઉપદ્રવીત પેશી શરૂઆતમાં જાંખા પીળા રંગની દેખાય છે તથા ત્યારબાદ ભૂખરા રંગના ધાબા પડેલા જોઈ શકાય છે. ઉપદ્રવીત ફળોનો વિકાસ અટકતા ફળોનું કદ નાનું રહે છે. અને ફળ કદરૂપું દેખાય છે. પરિણામે ફળની ગુણવત્તા બગડતા લીલા નાળિયેર (તરોકા) ના બજારભાવ પર વિપરીત અસર થાય છે. ફળની છાલ ખેંચાવાથી ઉભી તિરાડો જોવા મળે છે અને ક્યારેક વધુ ઉપદ્રવીત ફળોમાં ગુંદર જેવા પદાર્થનું જરણ પણ જોઈ શકાય છે. કથીરીના નુકશાનને પરિણામે કોપરાના ઉત્પાદનમાં ૩૦ ટકા તેમજ નાળિયેરના કુલ ઉત્પાદનમાં ૩૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયેલ છે. આવા ઉપદ્રવીત ફળોમાંથી મળતી કથીરીની ગુણવત્તા પણ નબળી હોય છે જેને પરિણામે ખેડૂતોને મળતી વધારાની આવક ઉપર ફટકો પડે છે. આવા છોતરાનો ફક્ત બળતણ તરીકે જ ઉપયોગ થઈ શકે છે. આ જીવતના નિયંત્રણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ ક્રીટકશાસ્ત્ર વિભાગ દ્વારા નીચે મુજબના પગલા હાથ ધરવા જણાવવામાં આવે છે.

જો કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો નાના કદના ફળો વૃક્ષ પરથી નીચે ખરી પડે છે. આવા ખરી પડેલા ફળોને ભેગા કરી બાળીને નાશ કરવો. નાળિયેરીના પાકમાં જાડ દીઠ ૫૦ કિગ્રા ગળતિયું ખાતર+ ૫ કિગ્રા લીબોળીનો ખોળ + ૧૫૦૦ : ૭૫૦ : ૧૫૦૦ ગ્રામ ના : ફો : પો (બે હત્તામાં) આપવું તથા એજાડીરેક્ટીન ૧૫૦૦ પીપીએમના દ્રાવણનો પાન પર વર્ષમાં ત્રણ વખત છંટકાવ કરવાથી ઇરીયોફીડ કથીરીનો ઉપદ્રવ કાબુલમાં રાખીને ગુણવત્તાયુક્ત ફળનું ઉત્પાદન મેળવી શકાય છે.

નાળિયેરીના જૂમખાઓમાં આવેલ નાના કદના ફળો પર જ છંટકાવ થવો જરૂરી છે. જ્યારે મોટા કદના ફળો એટલે કે આઈ મહિનાથી વધુ ઉમરનાં ફળો પર કથીરીની સંખ્યા નહિવત હોય છે. જંતુનાશકોનો છંટકાવ જાડ ઉપર ચઢીને અથવા લાંખા વાંસનો ઉપયોગ કરીને કરી શકાય છે. જો જાડ ઓછી ઉચાઈના હોય તો જાડ ઉપર ચઢનાર તેની સાથે ન્યુમેટીક હેન્ડ સ્પ્રેયર લઈ જઈ શકે છે. કારણ કે આ સ્પ્રેયરમાં એક લીટર દ્રાવણ ભરી શકાય છે જે જાડ પરના ૭ થી ૮ જૂમખાં પર છાંટવા માટે પૂરતું છે. નવી કથીરીનાશક દવાઓ જેવી કે મિલ્બેક્ટીન ૧ ઈસી (૫ મિ.લિ.) અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી (૫ મિ.લિ.) અથવા ફેનાઝકવિન ૫ એસસી (૧૦ મિ.લિ.) ૧૦ લીટર પાણીમાં ભેગવીને ઉપર જણાવ્યા મુજબ વ્યવસ્થિત છંટકાવ કરવો.

કથીરીના નિયંત્રણ માટે એક સાદી અને સરળ ઉપયોગી રીત છે જે મુજબ નાના ૨૫૦ મિ.લિ. પ્લાસ્ટીક પાઉચમાં ૨૫૦ મિ.લિ. પાણીમાં કોઈપણ નીમ બેઈજડ (લીમડાયુક્ત) દવા ૭.૫ મિ.લિ. મિશ્ર કરી તૈયાર કરવું પછી નાળિયેરીનું તાજું મૂળ સહેજ ખુલ્લાં કરી નીચેથી છેડા ઉપર કલખ ત્રાસો કાપ મૂકી ઉપર જણાવેલ દવાવાળું પાઉચમાં મૂળ દાખલ કરી ઉપરથી દોરી અથવા રેસા વડે બાંધી બંધ કરી દેવું. દવા મૂળ વાટે શોષાય જશે અને કથીરીનું નિયંત્રણ સહેલાઈથી થશે.

#### **૫. રેડ પામ વીવીલ :**

થડમાં કાણાં, કોઝી રંગનું દાવણ ઝરતું હોય અને ચાવેલ કુચા જોવા મળે તો તે રેડ પામ વીવીલનું નુકસાન સૂચવે છે. વધુ ઉપદ્વામાં પાન પીળારંગના થઈ પડી જાય છે.

**નિયંત્રણ:** ઉપદ્વાત જાડને કાપીને દૂર કરવા. આવા જાડને ફાડીને સણગાવી મૂકવા જેથી જીવાતનો નાશ થાય. જાડને ઈજા થતી અટકાવવી કારણકે આવી જગ્યાએ આ કીટક ઈડા મુકે છે. કલોરપાયરીઝોસ ૦.૦૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૨૫ મી.લી. દવા) નો છંટકાવ કરવો. પાન કાપતી વખતે પર્ષાંડ એક મીટર રહેવા દઈ કાપવું. ફેરામોન ટ્રેપથી કીટકને આર્કથીને મારી નાખવા.

#### **રોગો :**

##### **૧. અગ્રકલિકાનો સડો :**

શરૂઆતમાં એક કે બે કુમળા પાન પીળા પડે છે. પાછલા તથ્બકે પાનનો દડો સુકાઈને પીળો પડે છે. છેવટે આખું જુમખું પડી જાય છે અને જાડ મરી જાય છે. ચોમાસા દરમ્યાન ઉપદ્વા જોવા મળે છે. ઉપદ્વાત જાડના પાન અને જુમખું દૂર કરી બોર્ડોપેસ્ટ લગાવવી. ૧ % બોર્ડોમીશ્રણ પાનના જુમખા તથા આજુભાજુના જાડ પર છાંટવું. ઉપદ્વાત જાડને કાપી બાળીને નાશ કરવો.

##### **૨. પાનનાં ભૂરા ટપકા :**

કુંગથી થતો આ રોગ પોટાશની ઉષપવાળી જમીનમાં ખાસ કરીને નાની ઉમરમાં જાડમાં વિશેષ જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં પરિપક્વ પાન પર આછા પીળા ટપકાં જોવા મળે છે. જેને ફરતી કાળી કિનારી હોય છે. ત્યારબાદ આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ભૂખરો થઈ જાય છે અને તેને ફરતે પીળા અથવા પીળા લીલા રંગની ધાર જોવા મળે છે. રોગની તીવ્રતા વધતી પાનનો મોટો ભાગ સૂકાય જાય છે.

#### **નિયંત્રણ:**

૧. બગીચાની નિતારશક્તિ સુધારવી તેમજ પુરતા પ્રમાણમાં પોટાશયુક્ત ખાતર આપવાથી આ રોગની તિવ્રતા ઘટે છે.

૨. કાર્બેરેજીમ ૫૦ ટકા વે.પા. (૫ ગ્રામ / ૧૦ લિટર પાણી) અથવા એક ટકાવાળા બોર્ડોમિશ્રણનો છંટકાવ જરૂર મુજબ કરવો.

##### **૩. સૂકારો :**

નારિયેલીમાં ધાળા પ્રકારનાં સૂકારા નોંધાયેલ છે જેમાં કેટલાક સૂકારામાં રોગ શરૂ થયા બાદ થોડા વર્ષોમાં જાડ સૂકાય જાય છે. જ્યારે કેરાળા વિલ્ટવાળા જાડ વર્ષો સુધી જીવંત રહે છે. ધાળા સૂકારાનું ચોકકસ રોગકારક પણ જાણી શકાયેલ નથી.

#### **નિયંત્રણ:**

૧. સૂકારાગ્રસ્ત બગીચાની યોગ્ય માવજત કરવી.

૨. ભલામણ મુજબ ખાતર આપવું, નિયમિત પાણી આપવું તેમજ અન્ય જરૂરી ખેતીકાર્યો સમયસર કરવા.

૩. સેન્ટ્રિય ખાતરની સાથે ટ્રાઇકોડમાનો ઉપયોગ કરવો.

#### **કાચા નાળિયેર ખરી પડવા અંગે વિશેષ કાળજી :**

સામાન્ય રીતે નાળિયેરીનો પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસે માદા કૂલોનું ફ્લિનીકરણ થતું હોય છે. ફ્લિનીકરણ કિયા પૂર્ણ થયા બાદ ૨ માસ દરમ્યાન મોટાભાગના બટનો (ફ્લિનીકરણ ન થયેલા) ખરી પડે છે જેને ઘણીવાર બેડૂતો નાળિયેર ખરી પડે છે તેવું માને છે. પરંતુ નાળિયેરો વિકાસ થયા પછી જે ખરે છે તે જ સાચા નાળિયેર છે. જેનાં માટે ઘણા બધા કારણો જવાબદાર છે, જેવા કે હવામાન, પાણીની અનિયમિતતા, જાડની પરિપક્વતા, વારસાગત ગૂણધર્મો, પોષકતત્વોની ઉષપ, અંતઃસ્ત્રાવની ખામી, રોગ-જીવાત વગેરે. આ માટે નીચે મુજબની કાળજી લેવી સલાહ ભરેલી છે.

(૧) જાડની સંખ્યા એક કરતાં વધારે વાવવી.

- (૨) નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આપવા.
- (૩) નબળી ઉત્પાદનક્ષમતા ધરાવતા ઝડ બગીચામાંથી દૂર કરી બીજા વાવવા.
- (૪) સમયસર રોગ—જીવાતના નિયંત્રણના પગલા લેવા.
- (૫) કૂલ કાતરો (પુષ્પવિન્યાસ) ખૂલ્યા બાદ એક માસ પછી ૨, ૪-ડી, ૨૦ પી.પી.એમ. દ્રાવણનો કોતરા ઉપર છંટકાવ અઠવાડિયાના ગાળે ચાર વખત કરવો. (બજારમાં ઉપલબ્ધ બાગાયત ગ્રેડનાં ૨, ૪-ડી નો ૨૦ મી. ગ્રા. પાવડર થોડા પાણીમાં ઓગાળી તેમાં જરૂરી પાણી ઉમેરી ૧ લીટરનું દ્રાવણ બનાવવું. અથવા ૫ થી ૧૦ લીટર પાણીમાં ૫ મીલી લ્પાનોફિક્સ ઉમેરી વૃદ્ધિ નિયંત્રકનો છંટકાવ કરવાથી ફળધારણ થઈ વધુ ઉત્પાદન મળે છે.

### વીણી અને ઉત્પાદન :

સામાન્ય રીતે કૂલ આવ્યા બાદ ૧૨ માસે નાળિયેર પરિપક્વ થાય છે. નાળિયેર કાચા પીવા માટે ઉપયોગ કરવાનો હોય તો ૬-૮ માસની ઉમરે કે જ્યારે તેમાં વધારેમાં શર્કરા હોય છે ત્યારે કાચા નાળિયેર (તરોકા) ઉતારી શકાય. સારી માવજતમાં ઝડ દીઠ ૮૦-૯૦ નાળિયેરનું ઉત્પાદન મળે છે.

### કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની નારિયેરી પાકની વિકાસ યોજના :

રાજ્યમાં દરિયાકાંઠાના નાળિયેરી પાકના વાવેતર વિસ્તાર વધારી શકાય તેવી ભલામણ કરેલ નાળિયેરની હાઈબ્રિડ તથા સારી જાતોનું વાવેતર વધે, ઉત્પાદન વધે તે માટે નીચે મુજબના સહાયના ધોરણ અમલમાં છે.

અ.નં.	ઘટકનું નામ	સહાયનું ધોરણ
૧	નાળિયેરી પાકના નવા વાવેતરમાં સહાય	નાળિયેરી પાકના નવા વાવેતરમાં હેક્ટરે કૂલ – ૮૦૦૦ / – સુધી પ્રથમ વર્ષ ૫૦% હિસ્સો રૂ. ૪૦૦૦/- , બીજા વર્ષ ૪૦૦૦ / – મુજબ ૦.૧૦ થી ૪ હેક્ટર સુધી બોર્ડ દ્વારા ખેડૂતોને સીધી સહાય.
૨	નાળિયેરી પાકના નિર્દર્શન માટે સહાય	નાળિયેરી પાકના ઝડમાં કૃષિ યુનિ, ની ભલામણ મુજબ જરૂરી પોષક તત્ત્વો / પાક સંરક્ષણના ઇન્પુટનો ઉપયોગ કરી સારી ગુણવત્તાવાળા ઉત્પાદન માટેની ખેતી પદ્ધતિ અપનાવતા થાય તે માટેના નિર્દર્શન પ્લોટના ખર્ચ માટે બોર્ડ દ્વારા પ્રતિ હેક્ટરે કૂલ – ૩૫૦૦૦ / – સુધી પ્રથમ વર્ષ ૫૦% હિસ્સો બીજા વર્ષ ૫૦% હિસ્સો મુજબ ૦.૨૦ થી ૧.૦૦ હેક્ટર સુધી સપ્રમાણ સહાય આપવામાં આવે છે.
૩	ઓર્ગેનિક યુનિટ માટે સહાય	નાળિયેરી ઉગાડતા ખેડૂતોને સારી ગુણવત્તાનું ઉત્પાદન મળી શકે અને સારી ગુણવત્તાની ઓર્ગેનિક મેન્યોર બનાવતા થાય તે માટેના વર્મી કંમ્પોસ્ટ, કોર પીટ કંમ્પોસ્ટ / ફાર્મ યાર્ડ મેન્યોરના યુનિટ ઉભા કરવા માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૨૦૦૦૦ / – સુધીની યુનિટના વિસ્તારના સપ્રમાણમાં સહાય કોકોનટ બોર્ડ દ્વારા સીધી સહાય આપવામાં આવે છે.
૪	ખાંન્દીગ મટેરીયલ્સના ઉત્પાદન માટે નવી નર્સરી ઉભી કરવા માટે સહાય	નાળિયેરીની ઉચ્ચ ગુણવત્તા વાળું ખાંન્દીગ મટેરીયલ્સ (રોપા) ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે સરકારી સહકારી/ખાનગી સંસ્થા દ્વારા માતૃજાડની નવી મોટી નર્સરી ઉભી કરવા માટે ખર્ચના ૨૫ ટકા મુજબ મોટી નર્સરી ૪ (ચાર) હેક્ટરની ૫૦૦૦૦૦ કવોલીટી સીડલીંગ (સારી ગુણવત્તાના રોપા) ઉત્પાદન ક્ષમતાના બગીચા માટે ૫.૦૦ (છ) લાખ (પ્રથમ વર્ષ ૩.૦૦ લાખ બીજ અને બીજ અને ત્રીજા વર્ષ ૧.૫૦ લાખ મુજબ) તથા નાની નર્સરી ૦.૪૦ હેક્ટર સુધીના ૨૫૦૦૦ કવોલીટી સીડલીંગ ઉત્પાદન ક્ષમતાના બગીચા માટે ૨.૦૦ લાખ સુધીની પ્રોજેક્ટ બેઈજ આધારીત બોર્ડ દ્વારા સીધી સહાય આપવામાં આવે છે.

**બાગાયત ખાતાની મુખ્ય કચેરી, વિભાગીય કચેરી, /કોન્ટ્રિય કચેરીના સરનામાની વિગત**

ક્રમ	કચેરીનું સરનામું	ફોન નંબર
૧.	બાગાયત નિયામક, ગુ.રા. ગાંધીનગર. (વડા કચેરી) કૃષિજવન, બ્લોક - બી, પ્રથમ માળ, સેક્ટર - ૧૦ (અ) ગાંધીનગર	૦૭૯ - ૨૩૨૫૬૧૦૪
૨.	સંયુક્ત બાગાયત નિયામક, વડોદરા (વડોદરા વિભાગ) રાવપુરા પોલીસ ચોકીની પાછળા, કોઠી કંપાઉન્ડ, વડોદરા - ૩૬૦ ૦૦૧	૦૨૬૫ - ૨૪૨૭૬૪૭.
૩.	સંયુક્ત બાગાયત નિયામક, રાજકોટ (રાજકોટ વિભાગ) જિલ્લા સેવા સદન નં. ૨, પાંચમો માળ, રાજકોટ	૦૨૮૧ - ૨૪૫૪૬૭૫
૪.	નાયબ બાગાયત નિયામક, અમદાવાદ કૃષિ ભવન, બીજે માળ, પાલકી, અમદાવાદ -૩૮૦૦૦૭.	૦૭૯-૬૫૭૭૩૧૬
૫.	નાયબ બાગાયત નિયામક, અમેરીલ બાગાયત ભવન ચક્કર ગઢ રોડ સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં	૦૨૭૬૨-૨૨૩૮૪૪
૬.	નાયબ બાગાયત નિયામક, આણંદ જિલ્લા સેવા સદન, બીજે માળ રૂમ નં ૨૦૩, બોરસદ ચોકડી પાસે, આણંદ	૦૨૬૬૨ - ૨૬૨૦૨૩
૭.	નાયબ બાગાયત નિયામક, પાલનપુર, બહુમાળીભવન , રૂમ નં. ૧૪ જોરાવર પેલેસ, જિલ્લા - બનાસકાંઠા.	૦૨૭૪૨-૨૫૬૭૨૬
૮.	મદદનીશ બાગાયત નિયામક, ભરુય સોન તલવાડી, ગુજરાત ગેસ કંપનીની સામે, ભોલાવ, ભરુય.	૦૨૬૪૨-૨૬૩૮૫૦
૯.	નાયબ બાગાયત નિયામક, ભાવનગર ટેકનિકલ એચ્યુસ્કુલ કંપાઉન્ડ, નવા પરા, ભાવનગર	૦૨૭૮-૨૪૨૦૪૪૪
૧૦.	નાયબ બાગાયત નિયામક, દાહોદ રૂમનં. -૨૩૭ જીલ્લા સેવા સદન, બીજો માળ છાપરી, દાહોદ	૦૨૬૭૩-૨૩૮૨૫૧
૧૧.	મદદનીશ બાગાયત નિયામક, ડાંગ ખેતીવાડી કંપાઉન્ડ, ની સામે, સરદાર બજાર ચાર રસ્તા , આહવા, જિ. ડાંગ	૦૨૬૩૧-૨૨૧૨૭૩
૧૨.	નાયબ બાગાયત નિયામક, ગાંધીનગર બહુમાળી ભવન છઠો માળ પથિકાશ્રમની બાજુમાં ગાંધીનગર	૦૭૯-૨૩૨૫૭૭૬૦
૧૩.	નાયબ બાગાયત નિયામક, જામનગર ૩૦- દિવિજય પ્લોટ , જોડીયાવાલા બિલ્ડીંગ, જામનગર	૦૨૮૮-૨૬૭૪૨૧૭
૧૪.	નાયબ બાગાયત નિયામક, જુનાગઢ લધુ કૃષિ ભવન, બહુમાળી ભવન સામે, નીલમ બાગ જુનાગઢ.	૦૨૮૫-૨૬૩૫૦૧૬
૧૫.	નાયબ બાગાયત નિયામક, નડીયાદ (ખેડા), સરદાર પેટેલ ભવન, બ્લોક-૩ રૂમ નં. ૪, જી-ખેડા	૦૨૬૮-૨૪૫૦૬૨૪
૧૬.	નાયબ બાગાયત નિયામક, ભુજ(કર્ચ), બહુમાળી ભવન , બ્લોક નં. ૩૨૦, બીજે માળ, ભુજ જિ. કર્ચ.	૦૨૮૩૨-૨૨૨૭૬૩
૧૭.	નાયબ બાગાયત નિયામક, મહેસાણા જિલ્લા કચેરી સંકુલ, બ્લોક નં. ૧, બીજ માળ મહેસાણા	૦૨૭૬૨-૨૨૧૦૬૬
૧૮.	નાયબ બાગાયત નિયામક, રાજીપીપળા સેન્ટર બિલ્ડીંગ, રૂમ નં. ૭૨, ૭૩ બીજેમાળ, રાજીપીપળા, જિ. નર્મદા	૦૨૬૪૦-૨૨૧૮૮૬
૧૯.	નાયબ બાગાયત નિયામક, નવસારી પાણીની ટાંકી પાસે, જિલ્લા તિજોરી કચેરી સામે,નવસારી-૩૮૬૪૪૫	૦૨૬૩૭-૨૮૧૮૫૮
૨૦.	નાયબ બાગાયત નિયામક, ગોધરા જીલ્લા સદન રૂમ નં. -૮ ગોધરા-જિ. પંચમહાલ	૦૨૬૭૨-૨૪૦૦૩૬
૨૧.	નાયબ બાગાયત નિયામક, પાટણ બ્લોક-૩૩૫/૩૩૬, તિરૂપતિ માર્કેટ, બગવાડા દરવાજા,-૩૮૪૨૬૫	૦૨૭૬૬-૨૩૦૨૪૫
૨૨.	નાયબ બાગાયત નિયામક, પોરબંદર જિલ્લા સેવા સદન પ્રથમમાળ, રૂમ નં. -૨૦, સાંદીપની રોડ, પોરબંદર.	૦૨૮૬-૨૨૨૨૫૬
૨૩.	નાયબ બાગાયત નિયામક, રાજકોટ કલેક્ટર કચેરી કંપાઉન્ડ, રાજકોટ	૦૨૮૧-૨૪૪૫૫૧૭
૨૪.	નાયબ બાગાયત નિયામક, હિમંતનગર બહુમાળી ભવન, ભૌયતળીયે, હિમંતનગર, જિલ્લો-સાબરકાંઠા.	૦૨૭૭૨-૨૪૩૦૨૨
૨૫.	નાયબ બાગાયત નિયામક, સુરત બાગાયત ભવન, અઠવા લાઈન્સ, લાલબંગલા, સુરત-૧	૦૨૬૧-૨૬૫૫૮૪૮૮
૨૬.	નાયબ બાગાયત નિયામક, સુરેન્નગર બહુમાળી ભવન, બ્લોક-સી, બીજેમાળ, રૂમ નં.૨૦૭, ખેરાળી રોડ	૦૨૭૫૨-૨૮૨૭૬૩
૨૭.	નાયબ બાગાયત નિયામક, વારા જી-તાપી ઉનાઈ રોડ, ખેડુત તાલીમ કેન્દ્ર, વારા	૦૨૬૨૬-૨૨૧૪૨૩
૨૮.	નાયબ બાગાયત નિયામક,વડોદરા રાવપુરા પોલીસ ચોકીની પાછળા, કોઠી કચેરી કંપાઉન્ડ, રાવપરા, વડોદરા	૦૨૬૫-૨૪૨૭૧૫૩
૨૯.	નાયબ બાગાયત નિયામક, વલસાડ નીરા ભુવન, મોરારજી દેસાઈ ચોક, સ્ટેશન રોડ, વલસાડ-૩૬૬૦૦૧	૦૨૬૩૨-૨૪૩૧૮૩